

## PRIME FRESH LIMITED

Date: 25.08.2023

To, BSE Limited Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai- 400001

Dear Sir / Madam,

# Sub: Newspaper Advertisement regarding Addendum to Notice of 16<sup>th</sup> Annual General meeting ("AGM") of the Company through Video Conferencing/Other Audio Visual Means. Book Closure and E-voting information

### Ref: Company Code: BSE: 540404

Dear Sir / Madam,

Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 (as amended), Regulations 30, 44 and 47 of the SEB1 (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with General Circular Nos. 14/2020, 17/2020 and 20/2020 dated April 8, 2020, April 13, 2020 and May 5, 2020 and latest being 10/2022 dated December 28, 2022, respectively issued by the Ministry of Corporate Affairs and SEB1 Circular No. SEBI/HO/CFD/CMD1/ CIR/P/2020/79 dated May 12, 2020, copies of the newspaper advertisement published in "Business Standard" in English and in "Jai Hind" in Gujarati language on August 25, 2023 regarding Addendum to Notice of 16th AGM of the Company scheduled to be held on Friday, September 15, 2023 through Video Conferencing/Other Audio Visual Means facility, Book Closure and E-voting information are enclosed herewith. The same is also available on website of the Company at <u>www.primefreshlimited.com</u>;

You are requested to please take a note of the same and arrange to inform the members of exchange and public at large accordingly.

Thanking you,

Yours faithfully,

FOR PRIME FRESH LIMITED

J.J. Doshi

JASMIN DOSHI COMPANY SECRETARY & COMPLIANCE OFFICER



CHOLAMANDALAM INVESTMENT AND FINANCE COMPANY LIMITED

Corporate Office : C54 & 55. Sper B-4, Thiru Vi ka Industrial Estate. Guindy, Chennai 600032 Branch Office : 809-812, 8th Floor, Velocity TGB Road, Opp. Wood Square, L P Savani Main Road, Nr. Baleshwar Part Adajan, Surat-398009. Contact No: Nitin Panchal 9825438897 & Tejas Mehta-9825350047 / Amod Charan-93131188

SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES

#### PRIME FRESH LIMITED Aa CIN:L51109GJ2007PLC050404 Regd. Office: 102, Sanskar-2, Near Ketav Petrol Pump, Polytechnic Road, Ambawadi, Ahmedabad-380015, Gujarat.Phone:+9179-40320244 Email: info@primefreshlimited.com Website: www.primefreshlimited.com Corpor M.V. Ro Rajkot B ADDENDUM TO THE NOTICE OF 16TH ANNUAL GENERAL MEETING OF SHAREHOLDERS This is with reference to the Notice dated 16th August, 2023 sent to the Inis is with reference to the Notice dated for August, 2023 sent to the Shareholders for Convening 16th Annual General Meeting of the Company to be held on **Friday 15th September**, 2023 at 2.30 P.M. through Video Conferencing ("VC")/ other Audio visual Means ("OAVM"). The AGM Notice has been already sent to all the shareholders in due compliance with the provision of the Companies Act, 2013 read with rules made thereunder. Wherea and Re under s Author in the n The Notice of AGM Contains item No 6 pertaining to issuance of Equity Shares is hereb on Preferential Basis for Consideration of cash. After dispatching the notice the company had found that there are mismatch in calculation of Consideration proper amount as per proposed price wise-versa No. of Shares. in the Item No.6 and Act rea explanatory statement of Item No. 6. The bo The Addendum to the 16th AGM Notice for correction as mentioned above has been sent to the shareholders of the company via email and same has been submitted to the stock exchange. The said addendum is also being made available on the website of the company at www.primefreshlimited.com; redeem The bo the prop The addendum shall be deemed to be a part of the original Notice dated 16th August, 2023 and the notes provided therein. Other contents of the AGM Notice No. Co remain unchanged. For, Prime Fresh Limited 1 (Lo: Jinen Ghelani Date : 25-08-2023 Rajl Managing Director & CFO - DIN : 01872929 Place : Ahmedabad Niti (Bo **RBL BANK LTD.** D RBLBANK Jyo REGISTERED OFFICE: 1st Lane, Shahupuri, Kolhapur-41600 (Co National Office : 9th Floor, Techniplex-I, Off Veer Savarkar Flyover, Goregaon (West), Mumbai - 400 062. Place POSSESSION NOTICE Date : (For Immovable Property) Rule 8(1) Whereas, the undersigned being the Authorized Officer of RBL BANK LTD. under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security খ nterest Act 2002 and in exercise of powers conferred under section 13 (12) read with Rule 8 & 9 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated Oriental 14/12/2022 in respect of Loan A/c No. 809000231928, 809000645714 & 809002751657 alling upon the borrower/s borrowers M/s. Maruti Trading Co (Applicant), Mr Jitendrabhai Javantilal Khimani (Co-Applicant), Mr. Vasantkumar Jayantilal Where Khimani (Co-Applicant and Mortgagor), Mrs. Jasvantbhai Jayantilal Khimani (Co-Recon Applicant) to repay the amount mentioned in the notice being Rs.87,30,714.31/- total under outstanding amount due as on 14/12/2022 in the aforesaid Loan Account Nos. within 60 Dated davs from the date of receipt of the said notice. Bhara The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and repay the public in general that the undersigned has taken the Actual Physical Possession of the Thous property described herein below in exercise of powers conferred on him under Section 60 dav 13(4) of the said Act read with Rule 9 of the said rules on this date 20/08/2023. The B The borrower in particular and the public in general are hereby cautioned not to deal with Guara the property and any dealings with the property will be subject to the charge of **RBL BANK** LTD for an above mentioned amount and interest thereon. herein Rules of Description of the Immovable Property The Bo roper Property Owned by - Mr. Vasantkumar Jayantilal Khimani. Rs. 7. Residential Property bearing Plot No.237, admeasuring about 48.49 sq. mtrs, in the Paisa society known as "Bhagunagar Co-operative Housing Society Limited". constructed on mou land bearing Revenue Survey No.51/3 and 51/1 (as per computer record Revenue One Hu Survey No.51/3 Paiki 1 and 51/1, paiki 2), TO scheme no.03 (Karanj), Final Plot No.127 The bo and 133, situated at Mouje Village Karanj, Taluka and District Surat, Gujarat 395006, to redee boundaries thereof are more particularly mentioned in our Demand Notice dated 14/12/2022. Your attention is invited to provisions of section 13(8) of SARFAESI Act for All that redemption of secured assets i.e. property mentioned hereinbefore by tendering the bearin aforementioned outstanding dues together with all costs, charges and expenses Sagar incurred by our bank. Authorised Officer For const Date: 20-08-2023 **RBL BANK LTD** prope No. 15 Place: Surat Mr. Alpesh Shah Date: MAXIMUS INTERNATIONAL LIMITED CIN - L51900GJ2015PLC085474 b Regd. Office : 504A, OZONE, MAXIMUS Dr. Vikram Sarabhai Marg, Vadi-Wadi, INTERNATIONAL Vadodara - 390003, Gujarat. Tel No: (0265) 2345321 Email: info@maximusinternational.in Website: www.maximusinternational.in INFORMATION REGARDING 8TH ANNUAL GENERAL MEETING SALE C THROUGH VC / OAVM AND E-VOTING The un 1. Shareholders may note that the 8th Annual General Meeting (AGM) of the SARFAESI Act. Maximus International Limited (the 'Company') will be held through The Authorized Officer of M/s. RBL Bank Ltd, had already conducted multiple public auctions for selling the property, bu Video Conferencing (VC) / Other Audio-Visual Means (OAVM) on they turned out to be unsuccessful as no bids were received. Hence please be informed that if the total outstanding dues in the aforesaid loan account are not paid within Fifteen (15) Days from the date of this publication of this notice, then the Authorized officer will proceed for sale via private treaty of the property as stated below. Saturday, 30th September, 2023 at 02:30 pm in compliance with all the applicable provisions of the Companies Act, 2013 ('the Act') and Public at large is informed that the secured property as mentioned in the Schedule are available for sale through the relevant Rules made there under and the SEBI (Listing Private Treaty, as per the terms agreeable to the Bank for realization of Bank's dues on "AS IS WHERE IS" and "AS Obligations and Disclosure Requirements) Regulations, 2015 ('SEBI IS WHAT IS" BASIS Listing Regulations'), as amended from time to time, read with Standard terms & conditions for sale of property through Private Treaty are as under General Circular No. 10/2022 dated December 28, 2022 and other . Sale through Private Treaty will be on "AS IS WHERE IS" and "AS IS WHAT IS" BASIS. applicable circulars if any, issued by the Ministry of Corporate Affairs 2. The purchaser will be required to deposit 25% of the sale consideration on the next working day of receipt of Bank's acceptance of offer for purchase of property and the remaining amount within 15 days thereafter. 3. The purchaser has to deposit 10% of the offered amount along with application which will be adjusted against 25% of ('MCA') from time to time and SEBI vide its circular dated January 5, 2023 (hereinafter collectively referred to as the 'Circulars'), to transact he deposit to be made as per clause (2) above. the ordinary and special business set out in the Notice calling the 8th 4. Failure to remit the amount as required under clause (2) above, will cause forfeiture of amount already paid includin AGM ('Notice of the AGM'). 0% of the amount paid along with application. In compliance with the aforesaid Circulars. Notice of the AGM along with 5. In case of non-acceptance of offer of purchase by the Bank, the amount of 10% paid along with the application will be the Annual Report for the Financial Year 2022-23, will be sent only refunded without any interest. . The purchaser should conduct due diligence on all aspects related to the property (under sale through private treaty) through electronic mode to those Members whose email addresses are to his satisfaction. The purchaser shall not be entitled to make any claim against the Authorized Officer / Secured registered with the Company/Depositories. Members who have not Creditor in this regard at a later date. registered/updated their email addresses with the Depositories are 7. The Bank reserves the right to reject any offer of purchase without assigning any reason.

	-	larshan Commercial Center, Limda Chowk, Opp. Shastri Ma	
Securitisation ers conferred issued by the int mentioned mount, notice session of the 13 of the said e available, to	FL) under the Se xercise of power and Notice(s) is repay the amoun to repay the am has taken posse of the Section 1: respect of time	ESSION NOTICE (for immovab) thorized Officer of Aadhar Housing Finance Limited (AF and Enforcement of Security Interest Act 2002 and in e of the Security Interest (Enforcement) Rules 2002, Den e Borrower(s) / Guarantor(s) mentioned herein below to e of receipt of the said notice. The borrower having faile trantor(s) and the public in general that the undersigned cise of powers conferred on him under Sub-Section (4) est Enforcement rules, 2002. rovisions of sub section (8) of section 13 of the Act, in c in general are hereby cautioned not to deal with the pr	as, the undersigned being the Au construction of Financial Assets section 13(12) read with Rule 3 rised Officer of the company to the notice within 60 days from the dat by given to the Borrower(s) / Gua ty described herein below in exer d with Rule 8 of the Security Inter prover's attention is invited to p n the secured assets.
		of AHFL for an amount as mentioned herein under with i Description of Secured Asset	
	Date & Amount	(Immovable Property)	-Borrower(s) (Name of the Branch)
22-08-2023	15/05/2023 ₹ 6,91,174/-	All that piece and parcel of property bearing, R S No 16 P Asopalav Society Plot No 5 P Middle Sided Asopalav Society B H Marthak Tiles Nr. Tulsi Restaurant Off Station Road, Amreli, Gujarat, 365440. <b>Boundaries:</b> East: Plot No.5/P, West : Plot No.5/P, North: 6.10 Mt. Wide Road, South : Plot No.5/P	oan Code No. 04000004469/ ijkot Branch), tinbhai Ramjibhai Kareliya orrower), otsnaben Nitinbhai Kareliya o-Borrower)
fficer	Authorised Off	A - 44 -	: Rajkot
		Aadna	25-08-2023
A (833000) ty) ritization and	r Housing Finar <b>Lional</b> - VADODARA able Property inder the Securit	থানানা নীন্দ U punjab na argeted Resolution Action (SASTRA), CIRCLE 8(1)] POSSESSION NOTICE (For immovi e Authorized Officer of the Punjab National Bank u	Appendix-IV [See Rule ass, The undersigned being the
A (833000) ty) ritization and ers conferred mand Notice on Prop. Mr. iklal Shah to Lakh Twelve penses within e Borrowers / rty described e 8 of the said deal with the or an amount ty Four and ve Thousand	r Housing Finar CADODARA able Property der the Securit ercise of Power issued a Dema as Corporation Deepak Rasik Twenty One La terest and exper- by given to the land n of the propert read with Rule a utioned not to d tional Bank for Hundred Fifty Nine Lac Twelve	ereceit and the public in general is hereby ca operty will be subject to the charge of the Punjab National Bank u operation of the Punjab National Bank u d Enforcement of Security Interest Act, 2002 and in ep -3) the Security Interest (Enforcement) Rules, 2002 Borrowers / Guarantor / Mortgagor M/s Shreeji Sal Mrs. Jagrutiben B. Shah, Mr. Dhaval B. Shah & Mr obice being 7,21,12,730.05 (Rupees Seven Crore nd Paisa Five Only) as on 08.04.2022 with further in receipt of the said notice. for having failed to repay the amount, notice is here in general that the undersigned has taken Possession ferred on him/her under Section 13(4) of the said Act operty will be subject to the charge of the Punjab Na Crore Seventy Lakh Forty Four Thousand Four 2023 and interest thereon. B(2) till 31.07.2023 is Rs. 59,12,130.88 (Rupees Fifty	Stressed Assets T Appendix-IV [See Rule eas, The undersigned being the struction of Financial Assets an Section 13(12) read with (Rule 104.05.2022 calling upon the Is at Navnitlal Shah/Guarantors- the amount mentioned in the r sand Seven Hundred Thirty an 's from the date of notice/date of orrowers / Guarantor / Mortgag intor / Mortgagor and the public below in exercise of powers co on this 20th day of August of tt orrowers / Guarantor / Mortgag rty and any dealings with the pr 7,0,44,454.17 (Rupees Seven Seventeen Only) as on 31.07. Int Recovery after issuance of 13 lundred Thirty and paise Eighty- prower's attention is invited to p
A (833000) ty) ritization and ers conferred mand Notice on Prop. Mr. iklal Shah to Lakh Twelve benses within a Borrowers / rty described a 8 of the said deal with the or an amount ty Four and we Thousand me available,	r Housing Finar Attional - VADODARA able Property der the Securit ercise of Power issued a Dem- es Corporatior Deepak Rasik Twenty One La terest and exper- by given to the l n of the propert read with Rule & utioned not to d tional Bank for Hundred Fifty Nine Lac Twelve in respect of tim	SCRIPTION OF THE IMMOVABLE PROPERTY	Stressed Assets T Appendix-IV [See Rule eas, The undersigned being the struction of Financial Assets an Section 13(12) read with (Rule 104.05.2022 calling upon the B at Navnital Shah/Guarantors- the amount mentioned in the r sand Seven Hundred Thirty an ys from the date of notice/date of orrowers / Guarantor / Mortgag intor / Mortgagor and the public below in exercise of powers co on this 20th day of August of tt orrowers / Guarantor / Mortgag ty and any dealings with the pr 70,44,454.17 (Rupees Seven Seventeen Only) as on 31.07. Int Recovery after issuance of 13 lundred Thirty and paise Eighty- orrower's attention is invited to p even the secured assets.
A (833000) ty) ritization and ers conferred mand Notice on Prop. Mr. iklal Shah to Lakh Twelve benses within a Borrowers / rty described a 8 of the said deal with the or an amount ty Four and we Thousand me available, Moje Jetalpur for dAnand Hoje Jetalpur for dAnand d Floor. The d, West: Flat	r Housing Finar Attional - VADODARA able Property der the Securit ercise of Power issued a Dema- es Corporation Deepak Rasik Twenty One La terest and exper- by given to the I n of the propert read with Rule 8 utioned not to d tional Bank for Hundred Fifty Nine Lac Twelve in respect of tim t Vadodara, Moc 0. 16 on 2nd floo Et + 800 Sq Ft + 800 Sq Ft	Subject to the charge of the solution of	Stressed Assets T Appendix-IV [See Rule eas, The undersigned being the struction of Financial Assets an Section 13(12) read with (Rule 104.05.2022 calling upon the B at Navnital Shah/Guarantors- the amount mentioned in the r sand Seven Hundred Thirty an ys from the date of notice/date of orrowers / Guarantor / Mortgag intor / Mortgagor and the public below in exercise of powers co on this 20th day of August of tt orrowers / Guarantor / Mortgag intor / Mortgagor and the public below in exercise of powers co on this 20th day of August of tt orrowers / Guarantor / Mortgag rty and any dealings with the pr 70,44,454.17 (Rupees Seven Seventeen Only) as on 31.07.1 Int Recovery after issuance of 13 lundred Thirty and paise Eighty- orrower's attention is invited to p even the secured assets.
A (833000) ty) ritization and ers conferred mand Notice on Prop. Mr. iklal Shah to Lakh Twelve benses within a Borrowers / rty described a 8 of the said deal with the or an amount ty Four and we Thousand me available, Moje Jetalpur for dAnand Hoje Jetalpur for dAnand d Floor. The d, West: Flat	r Housing Finar Attional - VADODARA able Property der the Securit ercise of Power issued a Dema- es Corporation Deepak Rasik Twenty One La terest and exper- by given to the I n of the propert read with Rule 8 utioned not to d tional Bank for Hundred Fifty Nine Lac Twelve in respect of tim t Vadodara, Moc 0. 16 on 2nd floo Et + 800 Sq Ft + 800 Sq Ft	Subject to the charge of the Punjab National Bank us defined to repay the amount, notice is herein general that the undersigned has taken. Possession 13(4) of the said Action 13(4) of the sai	Stressed Assets T Appendix-IV [See Rule eas, The undersigned being the struction of Financial Assets an Section 13(12) read with (Rule 104.05.2022 calling upon the B at Navnital Shah/Guarantors- the amount mentioned in the r sand Seven Hundred Thirty an ys from the date of notice/date of orrowers / Guarantor / Mortgag intor / Mortgagor and the public below in exercise of powers co on this 20th day of August of tt orrowers / Guarantor / Mortgag ty and any dealings with the pr 70,44,454.17 (Rupees Seven Seventeen Only) as on 31.07. Int Recovery after issuance of 13 lundred Thirty and paise Eighty- orrower's attention is invited to p even the secured assets.

#### -auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and inforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 & 9 of the Security Interest (Enforcement) Rules, 2002. Iolice is hereby given to the public in general and in particular to the Borrower / Co-Borrower / Mortgagor (s) that the below described immovable roperties mortgaged to the Secured Creditor, the PHYSICAL POSSESSION of which has been taken by the Authorised Officer of Cholamandalam rosetiment and Finance Company Limited the same shall be referred herein after as Cholamandalam investment and Finance Company Limited. the Secured Assets will be sold on "As is where is", "As is what is" and "Whatever there is" basis through E-Auction. is hereby informed to General public that we are going to conduct public E-Auction through website https://www.auctionfocus.in/chola-lap. Reserve Price, E-Auction Date and Time, Date & Amount A/C No. & Name of Borrower, Co-borrower, Mortgagors Descriptions of the EMD & Bid Inc EMD Submission Last as per Demand Notice u/s 13(2) property/Properties mount (In Rs.) Date, Inspection Date Property 1: All that piece and Rs.1,95,50,000/parcel of immovable property bearing Office No. 618 on 6th floor Rs.19,55,000/-Rs.10,000/- Loan A/c No. HE01RHE00000011403 (1) Ishwar Vasudev Premjani, (2) Sanjeev Premjani, (3) Manju Ishwar Premjani, (4) Mohini Fashion, All are having add. B 802 Dream World Goerka School, Vesu, Surat, Gujarat. 395007, Also at : 6th Fir Shop No. 618/619 Raghuvir Textiles Mall, BhD D.r. World Mall, Puna Road Magob, Surat. Gujarat-395003 -oan A/c No. 1E01RHE00000011403 13-09-2023 at 11:00 ar to 1:00 PM (with unlimited extension of 5 min each), 16-03-2023 Rs. 2,63,81,167.00 as on 04-03-2023


Chola

Enter a better life

Gujarat-395003 admeasuring 20234 sq. mtrs. & block no.108 admeasuring 28429 sq.mtrs., preliminary T.P.Scheme no.34 (Magob-Dumbhal), original plot no.19 admeasuring 1505 sq.mtrs., final plot no.31 & 32 admeasuring 19300 sq.mtrs., & 1505 sq.mtrs., respectively paiki final plot no.32 admeasuring 1505 sq.mtrs., final plot no.31 & 32 admeasuring 19300 sq.mtrs., & 1505 sq.mtrs., respectively paiki final plot no.32 admeasuring 1505 sq.mtrs., final plot no.31 & 32 admeasuring 19300 sq.mtrs., & 1505 sq.mtrs., final plot no.11 admeasuring 7150 sq.mtrs., preliminary Lp.scheme no.34 (Magob-Dumbhal), original plot no.52 admeasuring 10016 sq.mtrs., preliminary Lp.scheme no.34 (Magob-Dumbhal), original plot no.32 admeasuring 10016 sq.mtrs., of moje village Magob, city of Surat, own by, Ishwar Vasudev Premjani. **Property** 2.14 Ithat piece and parcel of immovable property bearing **Office** No. 619 on 6th floor admeasuring 1248 sq. fts. carpet area, along with 52.75 sq.mtrs. undivided share in the land of "Raghuvir Textile Mall", situate at revenue survey no.58 hissa no.1 paiki, block no.108 as per 7/12 admeasuring 8195 sq.mtrs. & revenue survey no.58 hissa no.1 paiki block no.109, as per 7/12 admeasuring 20234 sq. mtrs., Tereliminary T.P.Scheme no.34 (Magob-Dumbhal), original plot no.32 admeasuring 28429 sq.mtrs., of moje village Magob & revenue survey no.66/2, block no.115 as per 7/12 admeasuring admeasuring 1505 sq.mtrs., of moje village Magob & grevenue survey no.66/2, block no.115 as per 7/12 admeasuring 10016 sq.mtrs., preliminary T.P.Scheme No.34 (Magob-Dumbhal), original plot no.25 admeasuring 10016 sq.mtrs., final plot no.41 admeasuring 7150 sq.mtrs., of moje village Magob, city of Surat, own by, **Ishwar Vasudev Premjani**.

All Interested participants / bidders are requested to visit the website https://www.auctionfocus.in/chola-lap & https://cholamandalam.com/news/auction-notices. For details, help, procedure and online training on e-auction, prospective bidders may contact M/s. Auction Focus Private Limited; Contact Prachi Trivedi Contact number; 9016641848.email.id; support@auctionfocus.in. For further details on terms and conditions please visit https://www.auctionfocus.in/chola-lap & https://cho notices to take part in e-auction

This is also a Statutory 15 Days Sale Notice Under Rule 8 & 9 of Security Interest (Enforcement) Rules, 2002 4.08.2023, Place : Surat Sd/- Authorized Officer, Cholamandalam Investment and Finance Company Limited ate : 24.08.2023, Place : Surat



### Mumbai Zone

<sup>5</sup> Floor, Block B, Jay Mangal House, Nr, Gandhigram Rly. Station, Ellisbridge, Ahmedabad-380009 • Tel. No. 079-26581891/92 Email : ahmedabadro@abhyudayabank.net

### NOTICE FOR SALE

Offers/Tenders are invited from the public/intending bidders for purchasing the following mmovable Property on "As is, Where is and What is basis", acquired under the provisions of Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest ct, 2002 and rules made thereunder:etails of Property :-

<b>U</b> 1.	ame of the Borrower and cured Debt to be recovered	Description of Property	Reserve Price Rs.
(2) 1. To Rs plu	) Mr. Sanjaykumar Gopalprasad Jaiswal (Property Owner) ) Mrs. Rita Sanjaykumar Jaiswal tal Dues :- s. 34,86,593.00 us Interest & Charges om 01.08.2023	All the premises being property bearing Flat No. B-66 on Sixth Floor admeasuring about 116 Sq. Yds. i.e. 96.99 Sq. Mtrs. at and in Tilakdhara Non Trading Association also known as "SHUBHDARSHAN TOWER" constructed on the land bearing Survey No.519 (Old Survey No. 1208, 1209 & 1210 - Vejalpur), T.P. Scheme No. 4, Final Plot No. 116/2 of Mouje-Jodhpur, Taluka City West, Registration District and Sub District Ahmedabad-4 (Paldi).	27.00 Lakh

- i.e. 10% of Reserve Price) amount to be transferred by RTGS to Account No. 070065100000001, IFSC code ABHY0065203 in favour of "Abhyudaya Co-operative Bank Ltd." on or before 14.09.2023 upto 5.00 p.m.
- · Premises will be kept open for inspection on 04.09.2023 and 05.09.2023 between 10:00 a.m. to 5:00 p.m.
- Title Documents of the property will be available for inspection at above mentioned office of Bank on any working day from 28.08.2023 to 14.09.2023 between 10.00 a.m. to 5.00 p.m.
- The Bank reserves its rights to accept/reject any offer and/or to modify and/or to cancel and/or to postpone the Auction/Bid.
- Online Auction will be conducted on 16.09.2023 between 3.00 p.m. to 4.00 p.m.
- The interested bidders are required to register themselves with the portal and obtain login ID and Password well in advance, which is mandatory for e-bidding, from auction service provider M/s. E-Procurement Technologies Ltd./Auction Tiger, B-704, Wall Street II, Opp. Orient Club, Nr. Gujarat College, Ellis Bridge, Ahmedabad 380006 Gujarat (India). Contact Nos.: Mr. Praveenkumar Thevar - 9722778828 - 079-35022145/149/182, praveen.thevar@auctiontiger.net and Contact person of Bank Mr. Vikas Sharma 8160827088.
- Detailed terms and conditions of the sale are set out in the Tender Forms which are available on Bank's website www.abhyudayabank.co.in as well as on https://sarfaesi.auctiontiger.net Sd/-Date :

: 25/08/2023	Authorised Officer
: Ahmedabad	Abhyudaya Co-op. Bank Ltd.

### **IDFC FIRST Bank Limited**

Place

CIN: L65110TN2014PLC097792 Registered Office: KRM Towers, 8th Floor, Harrington Road, Chetpet, Chennai - 600031. Tel: +91 44 4564 4000 | Fax : +91 44 4564 4022

**IDFC FIRST** Bank

**APPENDIX IV** [Rule 8(1)] **POSSESSION NOTICE (For immovable property)** 

requested to register/ update the email address and mobile number with

(ith IDFC Bank Limited) Capital First Limited and am

the	r relevant	depositories	through	Depository	Participants	with	whom
the	/ maintain	their demat a	iccounts.				

3. The Notice of the AGM and Annual Report for the Financial Year 2022-23 will also be available on the Company's website at www.maximusinternationl.in, website of the Stock Exchange i. Limited (BSE) at www.bseindia.com and on the website of Depository Services (India) Limited (CDSL), an agency appoir conducting remote e-voting, e-voting during the process of AG VC, at www.evotingindia.com

#### 4. E-voting and AGM through VC/OAVM Instructions:

- i) Member can attend and participate in the AGM ONLY VC/OAVM facility, the details of which will be provided Company in Notice of the AGM. Accordingly, no provision been made for Member to attend and participate in the 8th A the Company, in person. Members attending the meeting t VC/OAVM shall be counted for the purpose of reckoni guorum under the applicable provisions of the applicable law
- ii) Members will have an opportunity to cast their votes on business as set out in the Notice of the AGM through ele voting system (e-voting) facility provided by CDSL.
- iii) The manner of voting remotely (remote e-voting) by me holding shares in dematerialized mode and for members wh not registered their email address has been provided in the of the AGM. The details will also be available on the website Company, BSE and CDSL.
- iv) The facility of e-voting will also be made available at the Only those shareholders, who are present in the AGM t VC/OAVM facility and have not cast their vote on the busine out in the Notice of the AGM through remote e-voting a otherwise not barred from doing so, shall be eligible through e-voting system available during the AGM. By Order of the

9. The interested parties may contact the Authorized Officer for further details / clarifications and for submitting their application.

10. The purchaser has to bear all stamp duty, registration fee, and other expenses, taxes, duties, society dues in respec of purchase of the property.

with the provisions of SARFAESLAct / Bules Sale shall be in ac

8. In case of more than one offer, the Bank will accept the highest offer.

www.maximusinternationl.in,	website of the Stock Exchange i.e. BSE		shall be in accordance v		DULE		I
Depository Services (India) Li	dia.com and on the website of Central imited (CDSL), an agency appointed for e-voting during the process of AGM and	Loan Account No.	Name of Borrower/ Co-borrowers	Amount as per 13(2) Demand Notice under	Reserve price for private treaty		of Secured Assets/ able Properties
<ul> <li>VC, at www.evotingindia.com.</li> <li>E-voting and AGM through V         <ol> <li>Member can attend and VC/OAVM facility, the de Company in Notice of the been made for Member to the Company, in person. I</li> <li>VC/OAVM shall be coun quorum under the applicab</li> <li>Members will have an op business as set out in the voting system (e-voting) far</li> <li>The manner of voting re holding shares in dematerial</li> </ol> </li> </ul>	<b>/C/OAVM Instructions:</b> participate in the AGM ONLY through tails of which will be provided by the e AGM. Accordingly, no provision has attend and participate in the 8th AGM of Members attending the meeting through ted for the purpose of reckoning the le provisions of the applicable laws. portunity to cast their votes on all the e Notice of the AGM through electronic	809001 572109, 809002 664711, 809002 809440	M/s. Malu Tradelink (Applicant), Mr. Tarunkumar Gopalchand Malu (Co-Applicant), Mrs. Subhadra Gopalchand Malu (Co-Applicant) Mr. Gopalchand Pri Malu (Co-Applicant), Mrs. Seema Tarunk Malu (Co-Applicant), Ms. Pooja Devendra (Co-Applicant),	ks Rs. 9,19,36,352.43/- [Rupees Nine Crore Nineteen Lakhs Thirty Six Thousand Three Hundred Fifty Two and Forty Three Paisa Only] as on 17/03/2023 Demand notice cumar b, Date of	rs. 6,00,00,000/- (Rupees Six Crores Only)	Gopalchand Mal Gopalc Residential prope admeasuring 51 society known as " operative Hous constructed on r bearing Revenue S paiki, 15/1-2 paiki, 22/2, 22/1, 20/1, 23 T.P. Scheme no. situated at near ich Collage, Umra, St and surrounded b No.81, Towards S Towards West : P Towards West : P	l by - Mr. Tarunkumar u and Mrs. Subhadra shand Malu. orty bearing plot no. 80 14.22 sq. Mtrs. in the Shree Nehru Nagar Co- ing Society Limited" non agricultural land Survey No. 12 paiki, 25 , 22/5 paiki, 22/4, 22/3, 3/1, 23/2, 24/1 and 24/1, .5, final plot no. 125, nchhanath temple, SVR urat 395007, bounded y: Towards East: Plot South : Society Road, lot No.79 and Towards Plot No.99.
of the AGM. The details wi Company, BSE and CDSL iv) The facility of e-voting wil Only those shareholders, VC/OAVM facility and have out in the Notice of the	Il also be available on the website of the Il also be made available at the AGM. who are present in the AGM through e not cast their vote on the business set AGM through remote e-voting and are	of secure charges Correspo Ellisbridg	ed assets mentioned h and expenses incurred l ondence Address: Alpes ge, Ahmedabad-380006 5/08/2023	nereinabove by tendering th by the bank before the sale of esh Shah, Deputy Vice Presid	e aforementior f secured asse	ned outstanding dues ts. Ltd, 1st Floor, Viva C Authorised	s together with all costs,
otherwise not barred from	m doing so, shall be eligible to vote						
through e-voting system av	<b>U</b>						
through e-voting system av tte: 24.08.2023 ace : Vadodara बिंक ऑफ़ बड़ौदा Bank of Baroda	vailable during the AGM. By Order of the Board For Maximus International Limited Dharati Bhavsar Company Secretary Odhav Branch, Creata Ice- Plot No 296, Soni Ki Chawl, Near Tulei ( Ahmedabad-15 Gujarat, India. Plaoce: 91-079-2 Email: odhav@bankofbaroda.Plaoce: Web: w	Guest House 22892353 (D), ww.bankofba	, 22890421 (G) aroda.com SA	LE NOTICE (he	uritization and d Enforceme reinafter refe	mmovable/movable d reconstruction of nt of Security Int red to as the Act) 02 read with proviso to	f Financial Assets terest Act, 2002
through e-voting system av ate: 24.08.2023 ace : Vadodara <b>المحالي المحالي المحالي</b> <b>action Sale Notice for sale of Mova</b> auction Sale Notice for sale of Mova auction Sale Notice for sale of Mova	vailable during the AGM. By Order of the Board For Maximus International Limited Dharati Bhavsar Company Secretary Odhav Branch, Creata Ice- Plot No 296, Soni Ki Chawl, Nene: 91-079- Email: odhav@bankofbaroda.com Web: wr ble & Immovable Assets under the Securitization lies. 2002.	Guest House 22892353 (D), ww.bankofba and Reconst	22890421 (G) aroda.com SA	LE NOTICE (he	uritization and d Enforceme reinafter refe noterest Act, 20	d reconstruction of ent of Security Int rred to as the Act) 02 read with proviso to	f Financial Assets terest Act, 2002 Rule 6(2) & Rule 8(6) of
through e-voting system av ate: 24.08.2023 ace: Vadodara	vailable during the AGM. By Order of the Board For Maximus International Limited Dharati Bhavsar Company Secretary Plot No 296, Soni Ki Chawl, Near Tulsi ( Ahmedaba-15 Gujarat, India. Phone: 91-079- Email: odhav@bankofbaroda.com Web: wr ble & Immovable Assets under the Securitization les, 2002. real and in particular to the borrower(s) and Guarantor taken by the Authorized officer of the Bank of Baroda very of below mentioned account/s. The details of Borod rescription of the property with known e	Guest House 22892353 (D), ww.bankofba and Reconst (s) that the bel (Erstwhile De rrower/s/Guara encumbran	22890421 (G) aroda.com truction of Financial Asset ow described movable & imr na bank/Erstwhile Vijaya Ba antor/s/Secured Asset/s/Du nces	LE NOTICE (he	curitization and d Enforceme reinafter refer r Interest Act, 20 Vcharged to the B d on 12.09.202 & Time, EMD an As Rese	d reconstruction of ent of Security Int rred to as the Act) 02 read with proviso to	f Financial Assets terest Act, 2002 Rule 6(2) & Rule 8(6) of Dena bank/Erstwhile Vijaya ", "As is what is", and "Armedikt (NN HEDPEES) Contact No of the Branch Manager, Authorised officer
through e-voting system av te: 24.08.2023 ace : Vadodara <b>We are are are are are are are are are ar</b>	vailable during the AGM. By Order of the Board For Maximus International Limited Dharati Bhavsar Company Secretary Plot No 296, Soni Ki Chawl, Near Tulsi ( Ahmedaba-15 Gujarat, India. Phone: 91-079- Email: odhav@bankofbaroda.com Web: wr ble & Immovable Assets under the Securitization les, 2002. real and in particular to the borrower(s) and Guarantor taken by the Authorized officer of the Bank of Baroda very of below mentioned account/s. The details of Borod rescription of the property with known e	Guest House 22892353 (D), ww.bankofba and Reconst (s) that the bel (Erstwhile De rrower/s/Guara encumbran	22890421 (G) aroda.com truction of Financial Asset ow described movable & imr na bank/Erstwhile Vijaya Ba antor/s/Secured Asset/s/Du nces	AUCTION LEINOTICE ets and Enforcement of securit anovable properties hypothecate ank), secured creditor, will be sol ues/Reserve Price/e-Auction date Secured debt for recovery per Demand notice (I Recovery made after issuanc	Luritization and d Enforceme reinafter refei Interest Act, 20 Vicharged to the B J on 12.09.202 & Time, EMD and ess e of Reserve EMD D 09 09 055C C	d reconstruction of nt of Security Int red to as the Act) 02 read with proviso to ank of Baroda(Erstwhile I 3 on "As is where is' d Bid Increase Amount a rive Price, EMD Amount re Price: 18,04,000/- MD: 1.85 Lac eposit Account No. 1500015181869 Mac.BARBODHAVX	f Financial Assets terest Act, 2002 Rule 6(2) & Rule 8(6) of Dena bank/Erstwhile Vijaya ", "As is what is", and 'Amedikit (MA HOPPES) Contact No of the Branch Manager,
through e-voting system av te: 24.08.2023 te: Vadodara <b>The system age of the system age age of the system age of the system age age age age age age age age age age</b>	railable during the AGM. By Order of the Board For Maximus International Limited Dharati Bhavsar Company Secretary Odhav Branch, Creata Ice- Plot No 296, Soni Ki Chawi, Near 1016 ( Ahmedaba-15 Gujarat, India. Phone: 91-079- Email: odhav@bankofbaroda.com Web: wr ble & Immovable Assets under the Securitization les, 2002. rail and in particular to the borrower(s) and Guarantor taken by the Authorized officer of the Bank of Baroda rery of below mentioned account/s. The details of Boroda	Guest House 22892353 (D), ww.bankofba and Reconst (s) that the bel (cFstwhile Der rrower/s/Guara encumbran at no. B/13, 3 known as RA Asarva, Surve Ahmedabad I bounded as uth : Open Sp	22990421 (G) aroda.com truction of Financial Asset ow described movable & im na bank/Erstwhile Vijaya Ba antor/s/Secured Asset/s/Du nces Brd Floor, admeasuring JDEEP DUPLEX AND yn o.275/1, T.P. No.48, 6 (Naroda) standing in under: East: Common ace & Block-C	ACCTION ACC	Luritization and d Enforceme reinafter refe interest Act, 20 Webstein 12.09.202 & Time, EMD and As ess e of Reserve E EMD D IFSC C, (5TH CH	d reconstruction of int of Security Int red to as the Act) 02 read with proviso to ank of Baroda (Erstwhile I 3 on "As is where is' d Bid Increase Amount a rive Price, EMD Amount Price, 18,04,000/- MD: 1.85 Lac eposit Account No. 1500015181869 ode: BARBOODHAVX ARAACTER IS ZERO)	f Financial Assets terest Act, 2002 Rule 6(2) & Rule 8(6) of Dena bank/Erstwhile Vijaya ", "As is what is", and Manadikt (NN Reformes) Contact No of the Branch Manager, Authorised officer Shri Gyan Ranjan Prasad 9978446540 Shri Raju Kumar 9693666915
through e-voting system av the: 24.08.2023 ace : Vadodara <b>WWW Bark of Baroda</b> <b>WWW Bark of Baroda</b> <b>Aution Sale Notice for sale of Mova</b> <b>Security Interest (Enforcement R W</b> <b>Security Interest (Enforcement R W</b> <b>Security Interest (Enforcement R W</b> <b>Security Interest (Enforcement R W</b> <b>Security Interest (Enforcement R W</b> <b>Aution Sale Notice for sale of Mova</b> <b>Security Interest (Enforcement R W</b> <b>Aution Sale Notice for sale of Mova</b> <b>Security Interest (Enforcement R W</b> <b>Aution Sale Notice for sale of Mova</b> <b>Security Interest (Enforcement R W</b> <b>Aution Sale Notice for sale of Mova</b> <b>Aution Sale Notice for sale of Mova</b> <b>ApaRtm Wheth Sale Sale for and particular for an and <b>ApaRtm Wethown Sale Notice of Mr. San</b> <b>Passage &amp; Flat No.B</b> <b>ate &amp; Time of E-auctice</b> <b>Property Inspection</b></b>	railable during the AGM. By Order of the Board For Maximus International Limited Dharati Bhavsar Company Secretary Odhav Branch, Creata Ice- Plot No 296, Soni Ki Chawl, Near Tulsi ( Ahmedabad-15 Gujarat, India. Phone: 91-079- Temail: odhav@bankofbaroda.com Web: wr ble & Immovable Assets under the Securitization les, 2002. rail and in particular to the borrower(s) and Guarantor taken by the Authorized officer of the Bank of Baroda rery of below mentioned account/s. The details of Borda rescription of the property with known of arcel of immovable residential property bearing Fil Raj Divya Owners Association and the scheme i Jostrict of Ahmedabad and Registration Sub District Jay Ashok Pathi &Mr. Ashvin Ashokhan Pathi and 12, West : Open Space, North : Flat No. B/14, Sou ton : 12.09.2023 from 02.000 on Date & Time : 06-09-2023	guest House 22892353 (D), ww.bankofba and Reconst (s) that the bel (crstwhile Der rrower/s/Guara ancumbran at no. B/13, 3 shown as RA Asarva, Surve Ahmedabad I bounded as uth : Open Sp. PM to O( , 11:00	22890421 (G) aroda.com truction of Financial Asset ow described movable & im na bank/Erstwhile Vijaya Ba antor/s/Secured Asset/s/Du nces Brd Floor, admeasuring JDEEP DUPLEX AND yn 0.275/1, T.P. No.48, 6 (Naroda) standing in under: East: Common ace & Block-C 6.00 PM (With u AM to 01:00 PM	AUCTION LEINOTICE sta and Enforcement of securit movable properties hypothecate ank), secured creditor, will be sol ues/Reserve Price/e-Auction date Secured debt for recovery per Demand notice (1 Recovery made after issuand 13(2) demand notice) Rs. 20,99,803.07	uritization and d Enforceme reinafter refei Interest Act, 20 Weharged to the B ion 12.09.202 & Time, EMD an As ess e of Reserve E EMD D IFSC C, (5TH CH n of 10 m De of Poss	d reconstruction of int of Security Int red to as the Act) 02 read with proviso to ank of Baroda (Erstwhile I 3 on "As is where is' d Bid Increase Amount a rive Price, EMD Amount re Price: 18,04,000/- MD: 1.85 Lac eposit Account No. 1500015181869 ode:BARBOODHAVX ARAACTER IS ZERO) inutes duratio cession - Phys	f Financial Assets terest Act, 2002 Rule 6(2) & Rule 8(6) of Dena bank/Erstwhile Vijaya ", "As is what is", and 'Amedikit (MA VEGPEES) Contact No of the Branch Manager, Authorised officer Shri Gyan Ranjan Prasad 9978446540 Shri Raju Kumar 9693666915 on each)
through e-voting system av ate: 24.08.2023 ace: Vadodara <b>The system and s</b>	railable during the AGM. By Order of the Board For Maximus International Limited Dharati Bhavsar Company Secretary Odhav Branch, Creata Ice- Plot No 296, Soni Ki Chawl, Near Tulsi ( Ahmedabad-15 Gujarat, India. Phone: 91-079- Email: odhav@bankofbaroda.com Web: wr ble & Immovable Assets under the Securitization les, 2002. rail and in particular to the borrower(s) and Guarantor taken by the Authorized officer of the Bank of Baroda rery of below mentioned account/s. The details of Boroda rescription of the property with known en- arcel of immovable residential property bearing File Raj Divya Owners Association and the scheme a listrict of Ahmedabad and Registration Sub District jay Ashok Pati &Mr. Ashvin Ashokhal Patni and /12, West : Open Space, North : Flat No. B/14, Soci	Guest House 22892353 (D), ww.bankofba and Reconst (s) that the bel (c) sthat the bel (c) sthat the bel (c) stathe De rrower/s/Guar ancumbran at no. B/13, 3 shown as RA Asarva, Surve Ahmedabad bounded as uth : Open Sp. PM to O , 11:00 , purchaser on sc//ibapi.im	22990421 (G) aroda.com truction of Financial Asset ow described movable & imr na bank/Erstwhile Vijaya Ba antor/s/Secured Asset/s/Du nces Brd Floor, admeasuring JDEEP DUPLEX AND yon 275/1, T.P. No.48, 6 (Naroda) standing in under: East: Common ace & Block-C 6.00 PM (With L AM to 01:00 PM sale of immovable assets. Also prospective bidders i 0.000 lakhs is Rs.2500	AUCTION LEINOTICE sta and Enforcement of securit movable properties hypothecate ank), secured creditor, will be sol ues/Reserve Price/e-Auction date Secured debt for recovery per Demand notice (1 Recovery made after issuand 13(2) demand notice) Rs. 20,99,803.07 Rs. 20,99,803.07	Luritization and d Enforceme reinafter refei Interest Act, 20 Weharged to the B d on 12.09.202 & Time, EMD an As ess e of Reserve EMD D og IFSC C. (5TH CH n of 10 m De of Poss s of sale, Please of on above men hs is Rs.50000	d reconstruction of int of Security Int red to as the Act) 22 read with proviso to ank of Baroda(Erstwhile I 3 on "As is where is' d Bid Increase Amount a rove Price, EMD Amount re Price: 18,04,000/- MD: 1.85 Lac eposit Account No. 1500015181869 ode: BARBODHAVX ARAACTER IS ZERO) inutes duration cession - Physe refer to the link provided tioned contact nos. 1/-	f Financial Assets terest Act, 2002 Rule 6(2) & Rule 8(6) of Dena bank/Erstwhile Vijaya ", "As is what is", and 'Amedikit (MA VEGPEES) Contact No of the Branch Manager, Authorised officer Shri Gyan Ranjan Prasad 9978446540 Shri Raju Kumar 9693666915 on each)

Whereas the undersigned being the authorized officer of IDFC First Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 002, and in exercise of powers conferred under Section 13(12) of the said Act read with [rule 3] of the Security Interest (Enforcement Rules, 2002 issued a demand notices calling upon the Borrower/ Co-borrowers and Guarantors to repay the amount mentioned in the and notice appended below within 60 days from the date of receipt of the said notice together with further interest and other charge the date of demand notice till payment/realization.

Borrower/ Co-Borrowers/ Guarantors having failed to repay the amount, notice is hereby given to the Borrower/ Co-Borrowers rantors and public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of ers conferred on him/her under sub-section (4) of Section 13 of the Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules on this notice.

Loan	Borrower/s/	Description of	Dema	nd Notice	Date and Type of Possession Taken	
Account Number	Co-borrower/s & Guarantors Name	The Mortgaged Properties	Date	Outstanding Amount (Rs.)		
29855914	<ol> <li>Mohammedaslam Shaikh,</li> <li>Moirfan Arehman Shaikh,</li> <li>Salmabibi Abdulrehman Shaikh,</li> <li>Unique Lamination</li> </ol>	All That Piece And Parcel Of The Property Bearing Nondh No. 3946, Admeasuring 49 Sq. Yard I.E., 40.97.03 Sq. Mtrs., Situated At Ward No. 1 Of Badekha Chakla, Dhingali Faliya, City Of Surat, And Bounded As: East: Road, West : Nondh No. 3953, North : Nondh No.3945 South : Nondh No. 3947	18-01-2023	Rs. 14,60,790.34/-	23-08-2023 Symbolic Possession	
&	<ol> <li>Gulamfarid Hajibasir,</li> <li>N F Creation,</li> <li>Nabila Gulfamfarid Badiwala</li> </ol>	All That Piece And Parcel Of Immovable Property, Bearing Office No. 301on 3rd Floor, Admeasuring 21.28 Sq. Mtrs. (Carpet Area), Along With Undivided Share In The Land Of 'Sai Maya", Situated At Nondh No. 692-A & 694 Of Ward No. 2, Having Tenement No. 02a-13-2255 Of Udhna, City Of Surat, Gujarat, And Bounded As: East : Road, West : Nondh No. 692-B, North : Road Then Nondh No. 695-A, South : Road	23-11-2022	Rs. 16,17,887.14/-	23-08-2023 Symbolic Possession	
26691572	<ol> <li>Pushkarsingh Arjunsingh Rawnarajput</li> <li>Manju Kanwar</li> </ol>	All That Piece And Parcel Of Plot Of Land Bearing Flat No: 301, 3rd Floor, Having Carpet Area 275.14 Sq. FL, Built-Up Area 371 Sq. FL, Shree Mahavir Complex, Nr. Randel Mata Temple, Constructed On Pvt. Plot No. 18, 19, 20, Of Chandresh Nagar Tenaments, Bearing Block No. 89 Paiki, Sayan, Taluka Olpad, District Surat, Gujarat-394130, Along With Undivided Proportionate Share In The Land Admeasuring About 12.20 Sq. Mtrs., And, Bounded As : East : Other Flat No., West : Flat No. 302, North : Passage, South : Open Space		Rs. 3,74,127.45/-	23-08-2023 Symbolic Possession	
&	<ol> <li>Kishorbhai Diyalbhai Navadiya</li> <li>Bhavanaben Kishorbhai Navdiya</li> <li>Horbhai Diyalbhai Navadiya</li> </ol>	All That Piece Or Parcel Of Flat No. 202 Admeasuring 545 Sq. Ft. I.E. 50.64 Sq. Mtrs. (Super Built Up Area) & Admeasuring 366.27 Sq. Fts. I.E. 34.04 Sq. Mtrs. (Built Up Area) Alongwith Proportionate Undivided Share In Road & Parking Admeasuring 18.49 Sq. Mtrs. & Cop Admeasuring 2.07 Sq. Mtrs. Total Undivided Share Admeasuring 18.49 Sq. Mtrs., Building No. E-2, Second Floor, "Bhaktidhara Residency", Situated In The State : Gujarat, District: Surat, Sub-District & Taluka : Olpad, Moje : Sayan Bearing Survey Nos. 56, 57, 59 Paikee, Block No. 130 And Bounded As : East : Flat No. E/2-201, West : Nuilding No.E/1, North : Flat No. E/2-203, South : Open Space	17-02-2023	Rs. 6,90,977.07/-	23-08-2023 Symbolic Possession	
dealings with with IDFC B	h the property will be subject to ank Limited) for an amount m ce till payment/realization. 3-2023	in particular and the public in general is hereby ca o the charge of <b>IDFC First Bank Limited (erstwh</b> nentioned in the demand notice together with furth (erstwhile Capital First Limited an	ile Capital Fi er interest an	rst Limited and a d other charges fr Autho IDFC First I	malgamated om the date of Sd/- orised Officer Bank Limited	

### FRIDAY • 25-8-2023 03

### **JAI HIND - AHMEDABAD**

પહેલા રીટર્ન ભરો, પછી ટેક્સ ચુકવોઃઆવકવેરાની કરદાતાઓને નવી સુવિધા

નાણા ચુકવવા ૩૦ દિવસનો સમય મળશે અને તેમાં કોઈ પેનલ્ટી કે દંડાત્મક વ્યાજ નહી લાગે કરદાતા ટેકસ ચુકવવામાં ૩૦ દિવસથી વધુનો વિલંબ કરે તો દંડાત્મક વ્યાજ લાગ્ પડશે.નવી વ્યવસ્થા હેઠળ આવકવેરા રીટર્ન ફાઈલ કરાયા બાદ ટેકસ ચુકવવા માટેના બે વિકલ્પ ઉપલબ્ધ બનશે.પ્રથમ વિકલ્પમાં ઓનલાઈન પેમેન્ટની સુવિધા રહેશે. જયારે બીજા વિકલ્પમાં ટેકસ નહિં ચુકવનારને નોટીસ મળ્યાના ૩૦ દિવસમાં ટેકસ ચુકવવા પડશે. જોકે, બીજા વિકલ્પમાં કેટલીક શરતો રાખવામાં આવી છે. આ વિકલ્પ પસંદ કરનારને મોડો ટેકસ ચુકવવા બદલ જવાબદાર ગણીને વ્યાજ સહીત વધુ ટેકસ ચુકવવાનો મેસેજ મળી શકે છે.

### પ્રાઈમ ફેશ લિમિટેડ

CIN : L51109GJ2007PLC050404 રજીસ્ટર્ડ ઓફિસ : ૧૦૨, સંસ્કાર- ૨, કેતવ પેટ્રોલ પંપ પાસે, પોલીટેકનિક રોડ, આંબાવાડી, અમદાવાદ - ૩૮૦૦૧૫, ગુજરાત Phone : +91-79-40320244 Email : info@primefreshlimited.com Website : www.primefreshlimited.com શેરહોલ્ડરોની ૧૬મી વાર્ષિક સામાન્ય મીટિંગની નોટિસમાં ઉમેરો આ શુક્રવાર, ૧૫મી સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ બપોરે ૨.૩૦વાગે યોજાનારી કંપનીની સોળમી વાર્ષિક સામાન્ય સભા બોલાવવા માટે શેરહોલ્ડરોને પાંજા પર કેવવામાં આવેલી ૧૬મી ઓગસ્ટ, ૨૦૨૩ની નોટિસના સંદર્ભમાં છે. વીડિયો કોન્ફરન્સિંગ (\*VC\*) / અન્ય ઓડિઓ વિઝયુઅલ માધ્યમો (\*OAVM\*) દ્વારા, કંપની અધિનિયમ, ૨૦૧૩ ની જોગવાઈના યોગ્ય પાલનમાં તમામ શેરહોલ્ડરોને AGM નોટિસ પહેલા થી જ મોકલવામાં આવી છે. AGM નોટિસમાં રોકડની વચારણા માટે પ્રેકરન્શિયલ ધોરણે ઇકવિટી શેર AGM નોટિસમાં રોકડની વિચારણા માટે પ્રેકરન્શિયલ ધોરણે ઈકવિટી શેર ઈશ્યુ કરવા સંબધિત આઈટમ નં. દસામેલ છે. નોટિસ મોકલ્યા પછી કંપનીના ધ્યાનમાં આવ્યું હતું કે આઈટમ નં. દસાને આઈટમ નં. દના ખુલાસાત્મક નિવેદનમાં સુચિત કિંમત મુજબ વિચારણાની રક્રમની ગણતરી માં - શેરની સંખ્યામાં મીસ્મેચ થાય છે. ઉપર જણાવ્યા મુજબ સુધારા માટે ૧૬મી AGM નોટિસનો ઉમેરો કંપનીના શેરહોલ્ડરોને ઈમેલ દારા મોકલવામાં આવ્યો છે અને તે સ્ટોક એકસચેન્જમાં સબમિટ કરવામાં આવ્યો છે. આ ઉમેરો કરેલ કંપની વેબસાઈટ www.primefreshlimited.com પર પણ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.

આ ઉંમેરો ૧૬મી ઓગસ્ટ, ૨૦૨૩ની મૂળ નોટિસ અને તેમાં આપવામાં આવેલી નોંધ નો એક ભાગ માનવામાં આવશે. AGM નોટિસની અન્ય વિગતો યથાવત રહેશે.

**જિનેન દોલાણી** મેનેજિંગ ડિરેક્ટર & CFO - DIN : 01872929

### સંયુક્ત ખાતામાં ખાતાધારકોની સંખ્યામાં ફેરફાર ઓફિસે તેના બચત ખાતામાં કર્યા ત્રણ મોટા ફેરફાર

સેવિંગ એકાઉન્ટ ખોલી શકો છો, જેમાં તમને સુરક્ષાની સાથે સારા રિટર્નની ગેરંટી પણ મળે છે. જો તમે પશ પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. તાજેતરમાં, પોસ્ટ ઓફ્સિમાં આ ખાતાના નિયમોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર, ૩ જુલાઈ, ૨૦૨૩ના રોજ ઈ-નોટિફિકેશન છે કે આ તમામ ફેરફારો ખાતાધારકની સુવિધા માટે કરવામાં

નવી દિલ્હી, તા.૨૪ ઓફિસ તેના ગ્રાહકોને સંયુક્ત ઓફિસસેવિંગ્સસ્કીમસ્કીમહેઠળ પોસ્ટ ઓફિસના દેશભરમાં ખાતામાં માત્ર બે લોકો સાથે ખાતું હવે ૧૦મા દિવસથી મહિનાના કરોડો ગ્રાહકો છે જેમના માટે તે ખોલવાની મંજરી આપતી હતી, જે વિવિધ યોજનાઓ ચલાવે છે. હવે વધારીને ત્રેણ કરી દેવામાં રકમપર ૪ટકા વ્યાજદરનો લાભ બેંકોની જેમ તમે પણ પોસ્ટ આવી છે. આવી સ્થિતિમાં હવે મળશે. આ સાથે, આ વ્યાજની ઓફિસમાં જઈને પોસ્ટ ઓફિસ પોસ્ટ ઓફિસમાં એક સાથે ત્રણ ૨કમ આ વર્ષના અંતમાં બચત

સંયુક્ત ખાતાના નિયમો સિવાય સરકારે ખાતામાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં પણ ઘણા ફેરફાર કર્યા છે

શકશે. સંયુક્ત ખાતાના નિયમો સિવાય સરકારે ખાતામાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં પણ ઘણા ફેરફાર કર્યા છે. પોસ્ટ ઓફિસ જારી કરીને નાણા મંત્રાલયે પોસ્ટ સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા ઓફિસના બચત ખાતામાં ફેરફાર ઉપાડવા માટે હવે ગ્રાહકોએ ફોર્મ અંગે માહિતી આપી છે. નોંધનીય રને બદલે ફોર્મ ૩ સબમિટ કરવું પડશે. આ ફેરફાર બાદ હવે ગ્રાહક પાસબુક બતાવીને ખાતામાંથી આવ્યા છે. આવી સ્થિતિમાં, જો તમે ઓ છો માં ઓ છા ૫૦ રૂપિયા પણ પોસ્ટ ઓફ્સિમાં બચત ખાતું ઉપાડી શકશે. અગાઉ ૫૦ રૂપિયા ખોલાવવા જઈરહ્યા છો, તો તમારે માટે પણ ફોર્મર ભરીને અને આ નિયમો વિશે જાણવું જરૂરી છે. પાસબુક પર સહી કરીને પૈસા નોંધપાત્રવાત એછે કે, અંગાઉ પોસ્ટ ઉપાડવા પડતા હતા. પોસ્ટ

QUOTATION NOTICE Sealed Quotations are invited by Sewa Co-operative Federation, 21 & 22 Goyal Tower, University Road, Ahmedabad - the Implementing Agency (IA) of Kalakruti Garment Apparel Cluster, Ahmedabad from Reputed Machinery Suppliers / Manufacturers / Dealers / Agents. Email: info@sewafederation.org Phone: 079-29601503 The details of Machinery & Equipment are MACHINE QTY. 1 Nos Cupid Round Blade Cutting Machine Model No. : Cupoid 125 mm Novel Vacuum Table with inbuilt Boiler + Iron, Industrial RO 25 liters 1 Nos Pattern Cutting Table (1 No.) & Seating Table (25 nos.) 25 Nos **Canvas Fusing Machine Hydraulic** 1 Nos Embroidery Khatali (Standard Size) 10 Nos **Block Printing Toolkit** 10 No (Printing Color Binder, Fabric, Table per Centre, Peta, Tray) **Bar Coding Machine** 1 No THE LAST DATE FOR SUBMISSION OF QUOTATION IS 31-08-2023 UP TO 4.00 P

છેલ્લા દિવસ સુધી સૌથી ઓછી લોકો સેવિંગ એકાઉન્ટ ખોલાવી ખાતામાં જમા કરવામાં આવશે.

બીજી તરફ, જો કોઈ ખાતાધારકનું મૃત્યુ થાય છે, તો આવી સ્થિતિમાં ખાતાધારકને તે જ મહિનામાં વ્યાજની રકમ મળશે જેમાં વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

અભ્યુદચ

કો-ઓપ. બેંક લિ.

( મલ્ટી - સ્ટેટ શિક્યુલ્ડ બેંક)

ઈન્કમટેકસે એવી સ્પષ્ટતા કરી

છે કે કરદાતાઓ અમુક શરતો સાથે

આ સવિધા વિકલ્પ પસંદ કરી

શકાશે. જોકે, એડવાન્સ ટેકસ કે

ટીડીએસ જેવા ટેકસ પેમેન્ટમાં આ

આવકવેરા વિભાગનાં કહેવા

પ્રમાણે કરદાતા દ્વારા રીટર્ન દાખલ

કરવામાં આવ્યા બાદ નોટીસ

પાઠવવામાં આવશે અને ટેકસનાં

સુવિધાનો લાભ નહીં મળે.



#### જચમંગલ હાઉસ, બ્લોક–બી, ગાંધીગ્રામ રેલ્વે સ્ટેશન પાસે, એલીસબ્રીજ, અમદાવાદ–૩૮૦૦૦૯ • ફોન : ૦૭૯–૨૬૫૮૧૮૯૧/૯૨,

E-mail:ahmedabadro@abhyudayabank.net

વેચાણ માટેની નોટિસ

સિક્યુરીટાઇઝેશન એન્ડ રીકન્ષ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી એક્ટ, ૨૦૦૨ અને તે કાયદા અંતર્ગત નિયમો હેઠળ હસ્તગત કરેલ નીચે જણાવેલ સ્થાવર મિલક્ત "જેમ છે, જ્યાં છે અને જેવી છે" તે સ્થિતિમાં ખરીદવા માટે ઇચ્છુક ભહેર જનતા/બીડર પાસેથી ઓફર/ટેન્ડર મંગાવવામાં આવે છે સ્થાવર મિલકતની વિગત :-

ક્રમ	ધિરાણ લેનારના નામ	સ્થાવર મિલકતનું વર્ણન	અનામત
નં.	અને <del>કુ</del> લ લેણી સ્ક્રમ		કિંમત (રૂ)
۹.	(૧) શ્રી સંજયકુમાર ગોપાલપ્રસાદ જયસ્વાલ (મિલ્કત ગીરો મુકનાર) (૨) શ્રીમતી રીટાબેન સંજયકુમાર જયસ્વાલ સુલ લેણી સ્ક્રમ: રૂા.૩૪,૮૬,૫૯૩.૦૦ તથા તા. ૦૧–૦૮–૨૦૨૩ થી તઢતા વ્યાજ અને ખર્ચ સહિત	જિલ્લો અમદાવાદ, સબ–જિલ્લો અમદાવાદ–૪–પાલડી, મોષે–જોધપુર, તા–સીટી વેસ્ટ સર્વે નં. ૫૧૯, ટી.પી. સ્કીમ નં. ૪, ફા પ્લોટ નં. ૧૧૬/૨ (જૂના સર્વે નં. ૧૨૦૮,૧૨૦૯ અને ૧૨૧૦ – વેજલપુર) ની જમીન ઉપર આવેલ તિલક્ધારા નોન–ટ્રેડિંગ એસોસિએશન કે જે "શુભ દર્શન ટાવર" તરીકે ઓળખાય છે તેમાં આવેલ બ્લોક "બી" ના છક્ષ માળ પર આવેલ ફ્લેટ નં.દ્દ કે જેનું ક્ષેત્રફળ આશરે ૧૧૬ ચો.વાર (૯૬.૯૯ ચો.મી) છે તે મિલક્ત	૨૭.૦૦ લાખ

। fægs ਅਦੀદદાਦੇ/ બਿડਦોએ અਦનેસ્ટ મની ડਿਪોઝੀਟ (EMD) નੀ ਦકમ (અનામત કિંમતના ૧૦% ਦકમ એટલે કે રા.૨.૭૦/– લાખ) "અભ્યુદય કો–ઓપ બેંક લી." ની તરફેણમાં ખાતા નં. ૦૭૦૦૬૫૧૦૦૦૦૦૦૦૧, IFSC કોડ :

- ABHY0065203 માં RTGS મારફતે, તા. ૧૪/૦૯/૨૦૨૩ના રોજ સાંજે ૫.૦૦ કલાક સુધીમાં જમા કરાવાની રહેશે. ઉપરોક્ત મિલકત તા. ૦૪/૦૯/૨૦૨૩ અને ૦૫/૦૯/૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૦૦ કલાક થી સાંજે ૫.૦૦ કલાક સુધી
- નિરીક્ષણ માટે ઉપલબ્ધ રહેશે. • ઉપરોક્ત મિલકતના જરૂરી દસ્તાવેજો, તા. ૨૮/૦૮/૨૦૨૩ થી તા. ૧૪/૦૯/૨૦૨૩ દરમિયાન સવારે ૧૦.૦૦ કલાક થી સાંજે
- ૫.૦૦ કલાક સુધી નિરીક્ષણ માટે ઉપલબ્ધ રહેશે.
- કોઈપણ ઓફરનો સ્વીકાર / અસ્વીકાર કરવાની અને / અથવા હરાજી / બિડની શરતોમાં સુધારો કરવાની અને / અથવા હરાજી / બિડ ૨૯ / મૂલતવી રાખવાની સત્તા બેંક પાસે અબાધિત રહેશે.
- ઈ–ઓક્શન તા.૧૬/૦૯/૨૦૨૩ ના રોજ બપોરે ૩.૦૦ કલાક થી ૪.૦૦ કલાક દરમિયાન કરવામાં આવશે

નવી દિલ્હી તા.૨૪ જ આવકવેરાની રકમ ચુકવવી પડે છે. ટેકસ પેમેન્ટ વિના રીટર્ન દાખલ થઈ શકતુ નથી.

કહ્યુ કે કોઈ કારણોસર કરદાતા 🥰

રીટર્નની સાથે જ ટેકસ ચુકવી 🌽

શકતા સમર્થ ન હોય તો મોડી ચુકવણીની વ્યવસ્થાનો લાભ લઈ

આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓ માટે પહેલા રીટર્ન ભરો ટેકસ પછી ભરજો, સુવિધા શરૂ કરવામાં આવી છે જે 👘 આવકવેરા વિભાગનાં સૂત્રોએ

# ૩૦ દિવસમાં ટેકર્સ ચુકવણીની સવલત, વધુ મોડુ થાય તો પેનલ્ટી-વ્યાજ લાગુ થશે : એડવાન્સ ટેક્સ કે ટીડીએસ જેવી કરચુકવણીમાં લાભ નહીં 🌠

અંતર્ગત કોઈપણ કરદાતા રીટર્ન સમયસર ફાઈલ કરી દીધા બાદ ટેકસની ચુકવણી પછી કરી શકશે. વેબસાઈટ પર આવકવેરા વિભાગે આ વિકલ્પ પેશ કરી દીધો છે.

પ્રવર્તમાન વ્યવસ્થા હેઠળ કરદાતાઓએ રીટર્નની સાથોસાથ

બિહારમાં શિક્ષકોની ભરતી માટે બિહાર પબ્લિક સર્વિસ કમિશનની યોજાયેલી પરીક્ષા દરમિયાન રાજ્યના પાટનગર પટનામાં એક પરીક્ષા કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા આપવા આવેલા નજરે પડે છે.

### શાકભાજીના વધતા ભાવથી કચારે મળશે છૂટકારો?

## સામાન્ય જનતા વધતી જતી મોંઘવારીના કારણે ચિંતિત નવી દિલ્હી. તા.૨૪ | જબરદસ્ત વધારો થયો છે, પરંતુ સરકારે યોગ્ય

સમયે ટામેટાંના ભાવને અંકુશમાં લેવા માટે અનેક ભારતમાં સામાન્ય જનતા વધતી જતી મોંઘવારીના કારણે ચિંતિત છે. છેલ્લા બે મહિનામાં પગલાં લીધાં છે. આ સાથે જબજારમાં ટામેટાનો દેશમાં ટામેટા, ડુંગળી સહિત અનેક શાકભાજીના નવા પાક આવવાના કારણે તેની કિંમતમાં ભાવમાં જબરદસ્ત વધારો થયો છે. આવી સ્થિતિમાં 🕴 જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. ડુંગળીની


સવાલ એ ઉઠે છે કે શાકભાજીની મોંઘવારીમાં ક્યાં સુધી રાહત મળશે. આ પ્રશ્નનો જવાબ આપતા ઈમેંગવર્નર શક્તિકાંત દાસે બુધવારે કહ્યું કે સપ્ટેમ્બર સુધીમાં શાકભાજીની

કિંમતમાં મોટો ઘટાડો થઇ શકે છે. એક કાર્યક્રમમાં | આરબીઆઈ ગવર્નરે કહ્યું કે સરકારે યોગ્ય સમયે હસ્તક્ષેપ કર્યો છે. આના કારણે દેશમાં અનાજની કોઈ અછત નથી અને યોગ્ય પુરવઠાને કારણે કિંમતને અંકુશમાં રાખવામાં મદદ મળી છે. આ સાથે તેમણે કહ્યું કે, જો કે મોંઘવારીનો દર હજુ પણ અપેક્ષા કરતા વધારે છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં એવા સંકેતો જોવા મળી રહ્યા છે કે આગામી દિવસોમાં મોંઘવારીમાંથી રાહત મળે તેવી અપેક્ષા છે. RBI ગવર્નરે કહ્યું હતું કે જૂલાઈથી ભારતમાં શાકભાજીના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ટામેટાંને કારશે મોંઘવારી દરમાં ધારશા છે.





મોંઘવારીમાં ઘટાડો જોવા મળી શકે છે. નોંધનીય છે કે છૂટક ફુગાવાના દરમાં જૂલાઇમાં જબરદસ્ત વધારો નોંધવામાં આવ્યો છે અને તે ૭.૪૪ ટકાના સ્તરે ૧૫ મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. જૂલાઈમાં મોંઘવારીમાં જબરદસ્ત વધારો થવા પાછળનું મુખ્ય કારણ શાકભાજી છે. નોંધનીય છે કે  $\operatorname{RBI}$ ગવર્નરને આશા છે કે શાકભાજીના ભાવમાં ઘટાડા પછી આગામી સમયમાં છૂટક ફુગાવાના દરમાં જબરદસ્ત ઘટાડો નોંધાઈ શકે છે અને ત્રીજા ક્વાર્ટર સુધીમાં તે ઘટીને ૫.૭ ટકા થવાની



નવી દિલ્હી તા.૨૪ ચાલ, નાણાકીય વર્ષથી તમારુ આવકવેરા રિટર્ન ફક્ત ૧૦ દિવસમાં જ મળી જાય તો આશ્ચર્ય પામતા નહી. આવકવેરા વિભાગે હવે એવા મિકેનીઝમ પર કામ શરૂ કર્ય છે કે જેમાં હાલ સરેરાશ રીતે ૧૬ દિવસમાં આઈટી રિફંડ મળે છે તેના બદલે ફક્ત ૧૦ દિવસમાં જ મળી જાય તે ચાલુ નાણાકીય વર્ષમાં શકય બનાવશે. ૨૦૨૨-૨૩માં સરેરાશ રીતે આવકવેરા ખાતાએ ૧૬થી૧૭ દિવસમાં રિફંડ ચુકવ્યા હતા. અગાઉના વર્ષે તે સમયગાળો ૨૬ દિવસનો હતો અને તેના અગાઉ રિફંડ મળવામાં ત્રણ માસ જેટલો સમય લાગતો હતો પરંતુ હવે તે વધુમાં વધુ સરેરાશ રીતે ૧૦ દિવસમાં જ મળી જાય તે નિશ્ચિત કરવા પ્રયત્ન કર્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ટેકસ રીફંડનું પ્રમાણ પણ ઉંચુ રહેશે. આવકવેરા ખાતાએ ગત વર્ષના રિટર્નમાં ૧ એપ્રિલથી ૨૧ ઓગષ્ટ સુધીમાં રૂા.૭૨૨૧૫ કરોડનું રીફંડ ચુકવી દીધું છે. જેમાં રૂા.૩૪૪૦૬ કરોડ વ્યક્તિગત કરદાતાઓના છે. કુલ રૂા.૫.૮૮ લાખ કરોડનું નેટ ટેકસ કલેકશન થયું છે પણ હવે રેવન્યુ વિભાગે ટેકનોલોજીને વધુ બહેતર બનાવી છે અને એક તબકકે જે રિટર્નમાં કોઈ કવેરી ન હોય તેને ૨૪થી૪૮ કલાકમાં રિફંડ મળી જાય તે નિશ્ચિત કરવા જઈ રહ્યું છે.

આદિનાથ એક્ઝીમ રીસોર્સીસ લિમિટેડ CIN: L65100GJ1995PLC024300 REGI. OFFICE : 601, Astron Tower, Opp. Iskon Mandir, Nr. Casalla Tower, Satellite, Ahmedabad - 380015 Ph. 6351738619 : E-mail:aerInodalofficer@gmail.com natheximres Website: www.ad ૨૯મી વાર્ષિક સાધારણ સભાની સુચના- શેરધારકો માટે આથી સૂચના આપવામાં આવે છે કે કંપનીની ૨૯મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) સોમવાર,

૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે વીડિયો કોન્ફરન્સ ("વીસી")/અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમ (''ઓએવીએમ'') દ્વારા યોજાશે. કંપની ધારા, ૨૦૧૩ ની તમામ લાગુ પડેલ જોગવાઈઓ અને તેના બનાવેલા નિયમોના પાલનમાં કોર્પોરેટ બાબતોના મંત્રાલય ("એમસીએ") દ્વારા જારી કરાયેલ તારીખ ૨૮ ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજનો સામાન્ય પરિપત્ર નંબર૧૦/૨૦૨૨ અને ,પરિપત્ર નંબર SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 તારીખ ૦૫ જાન્યુઆરી, ૨૦૨ ૩ના રોજ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ("સેબી") દ્વારા જારી કરાયેલ આ સંદર્ભમાં, સેબી દ્વારા બહાર પાડવામાં આવેલા અન્ય પરિપત્રો સાથે વાંચવામાં આવે છે (સામૂહિક રીતે સંદર્ભિત "સેબીના પરિપત્રો" તરીકે), કંપનીઓને ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩સુધી સામાન્ય સ્થળે સભ્યોની હાજરી વિના વીસી અથવા ઓએવીએમ દ્વારા એજીએમ બોલાવવાની પરવાનગી છે. તે મુજબ, કંપનીની એજીએમ વીસી / ઓએવીએમ દ્વારા યોજવામાં આવે છે. એનએસડીએલ દ્વારા પ્રદાન કરવામાં આવેલ ઈલેક્ટ્રોનિક પ્લેટફોર્મ દ્વારા સભ્યોને એજીએમમાં હાજરી આપવા માટેની સુવિધા આપવામાં આવશે.

ઉપરોક્ત પરિપત્રો અનુસાર, વાર્ષિક અહેવાલ ૨૦૨૨-૨૩ સાથે એજીએમની સૂચના ફક્ત તે સભ્યોને જ ઇલેક્ટ્રોનિક મોડ દારા મોકલવામાં આવે છે જેમના ઈ-મેલ સરનામા કંપની/ડિપોઝિટરીઝમાં નોંધાયેલા છે. સભ્યો નોંધ લે કે એજીએમ અને વાર્ષિક અહેવાલ ૨૦૨૨-૨ ૩ની સૂચના કંપનીની વેબસાઇટ adinatheximresources.com, સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ એટલે કે બીએસઇ લિમિટેડ એટલે કે www.bseindia.com અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ હશે. "એનએસડીએલ") https://www.evoting.nsdl.com પર. સભ્યો ક્રક્ત વીસી / ઓએવીએમ સુવિધા દ્વારા એજીએમમાં હાજરી આપી શકે છે અને ભાગ લઈ શકે છે.

કંપની એજીએમની સૂચનામાં નિર્ધારિત તમામ ઠરાવો પર તેમનો મત આપવા માટે તેના તમામ સભ્યોને રિમોટ ઈ-વોટિંગ સુવિધા ("રિમોટ ઈ-વોટિંગ") પૂરી પાડી રહી છે. વધુમાં, કંપની એજીએમ ("ઈ-વોટિંગ") દરમિયાન ઈ-વોટિંગ સિસ્ટમ દ્વારા મતદાન કરવાની સુવિધા પૂરી પાડે છે. એજીએમ દરમિયાન ફિઝિકલ મોડમાં શેર ધરાવતા સભ્યો અને સભ્યો કે જેમણે કંપની સાથે તેમનું મેઇલ આઈડી રજીસ્ટર કરાવ્યું નથી, તેમના દ્વારા એજીએમ દરમિયાન રિમોટ ઈ-વોટિંગ/ઈ-વોટિંગ માટેની વિગતવાર પ્રક્રિયા એજીએમની સૂચનામાં આપવામાં આવશે.

જો સભ્ય(ઓ)એ અત્યાર સુધી કંપની/ડિપોઝિટરીઝ/રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ (આરટીએ) સાથે તેમના ઈ-મેલ સરનામાંની નોંધન્ની કરાવી નથી, તો નીચેની રીતે તેમના ઈ-મેલ સરનામાંની નોંધણી/અપડેટ કરવા વિનંતી કરવામાં આવે છે:

- અ. ડીમેટ મોડમાં શેર ધરાવતા સભ્યો તેમના સંબંધિત ડિપોઝિટરી પાર્ટિસિપન્ટનો સંપર્ક કરીને તેમના ઈમેલ આઈડી રજીસ્ટર કરાવી શકે છે.
- બ. ફિઝિકલ મોડમાં શેર ધરાવતા સભ્યો કંપનીને aerlnodalofficer@amail.com પર અથવા આરટીએ એટલે કે Bssahd@bigshareonline.com પર બીગશેર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડને ફોલિયો નંબર, શેરધારકનું નામ, શેરની સ્કેન કરેલી નકલ (આગળ અને પાછળ) જેવી જરૂરી વિગતો પાન અને આધાર (સ્વ-પ્રમાણિત સ્કેન કરેલી નકલ), તેમજ પોતાનો કોન્ટેક નંબર આપીને વિનંતી મોકલી શકે છે.

ઉપરોક્ત સર્વે માહિતી કંપનીના તમામ સભ્યોની હિતને ધ્યાનમાં રાખીને અને એમસીએ સર્ક્યુલર્સ અને સેબી સર્ક્યુલર્સ ના પાલન આધીન આપેલા છે

બોર્ડના આદેશ અનુસાર આદિનાથ એક્ઝીમ રીસોર્સીસ લિમિટેડ સહી અર્પિતા શાહ

3IPI3KKS : NPS કંપની સેકેટરી અને કોમ્પલાઈન્સ ઓકિસર વારીખ : ૨૫-૦૮-૨૦૨૩

Place : Ahmedabad Mittal Shah, Managing Direct Date : 24.08.2023 SEWA Co-operative Federation



શ્રી ગણેશ રેમેડીઝ લીમીટેડ CIN No. : L24230GJ1995PLC025661 રજીસ્ટર્ડ ઓફીસ : પ્લોટ નં. ૬૦૧૧, G.I.D.C., અંકલેશ્વર- ૩૯૩૦૦૨, ગુજરાત, ભારત. s)a : 02EXE-220000 Web.: www.ganeshremedies.com | Email : investors@ganeshremedies.com

### ૨૮મી વાર્ષિક સાધારણ સભાની નોટિસ

આથી નોટિસ આપવામાં આવે છે કે, શ્રી ગણેશ રેમીડીઝ લિમીટેડ (''કંપની'')ન સભ્યોની ૨૮મી વાર્ષિક સાધારણ સભા (એજીએમ) સોમવાર, ૧૮મી સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ સવારે ૧૧.૩૦ કલાકે (IST), સભ્યોને મોકલવામાં આવનાર એજીએ ની નોટિસમાં દર્શાવવામાં આવ્યા મુજબનાં નિર્ધારિત કામકાજ હાથ ધરવા માટે, વિડિયં કોન્ફરન્સ (''વીસી'') / અન્ય ઓડીયો વિઝયુઅલ માધ્યમ (''ઓએવીએમ'') દ્વાર યોજાશે. કંપનીઝ એક્ટ, ૨૦૧ ૩ની લાગુ જોગવાઇઓ અને કોર્પોરેટ બાબતોનાં મંત્રાલય દ્વારા જારી કરાયેલા અનુક્રમે સામાન્ય પરિંપત્ર નં. ૧૪/૨૦૨૦તા. ૮મી એપ્રિલ, ૨૦૨૦ સામાન્ય પરિપત્ર નં. ૧૭/૨૦૨૦ તા. ૧૩મી એપ્રિલ,૨૦૨૦, સામાન્ય પરિપત્ર નં ૨૦/૨૦૨૦ તા.૦૫મી મે,૨૦૨૦, સામાન્ય પરિષત્ર નં.૦૨/૨૦૨૧ તા. ૧૩મી જાન્યુઆરી, ૨૦૨૧, સામાન્ય પરિપત્ર નં. ૨૧/૨૦૨૧ તા.૧૪મી ડિસેમ્બર,૨૦૨૧ સામાન્ય પરિષત્ર નં. ૦૨/૨૦૨૨ તા.૦૫મી મે,૨૦૨૨ અને સામાન્ય પરિષત્ર નં ૧૦/૨૦૨૨ તા.૨૮મી ડિસેમ્બર,૨૦૨૨ (એમસીએ પરિષત્રો) અને સિક્યોરીટી: એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલ અનક્રમે પરિપત્ર ન SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 તા.૧૫મી જાન્યુઆરી SEBI/HO/DDHS/P/CIR/2022/0063 તા.૧૩ મી મે ૨૦૨૨ અને પરિંપત્ર નં SEBI/HO/CFD/PoD- 2/P/CIR/2023/4 તા. ૦૫ મી જાન્યુઆરી, ૨૦૨૩ન (સેબી પરિપત્રો) ને અનુસરીને ૨૮મી એજીએમની નોટિસમાં નિર્ધારિત કામકાજ કરવ માટે યોજાશે.

જે શેરધારકોનાં ઇ-મેઇલ આઇડી કંપની / ડિપોઝીટરી સહભાગી સાથે રજિસ્ટર્ડ છે અં તમામ શેરધારકોને ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા ૨૮મી એજીએમની નોટિસની ઇલેક્ટ્રોનિક નકલ, જેમાં ઇ-વોટિંગ માટેની પ્રક્રિયા અને સુચનાઓ સામેલ છે તેમજ નાણાંકિય વપ ૨૦૨૨-૨૩ માટેનાં વાર્ષિક અહેવાલ મોકલવવામાં આવશે.

જે સભ્યોએ તેમનાં ઇ-મેલ એડ્રેસ નોંધાવેલ નથી તેઓએ તેમનાં ઇ-મેલ એડ્રેસ વહેલાસ નોંધાવી લેવા વિનંતી :

- અ) ડિમેટ મોડમાં શેર ધરાવનાર માટે : તેઓનાં ડિપોઝીટરી સહભાગીઓ (ડીપી પાસે :
- બ) ફીઝીકલ મોડમાં શેર ધરાવતા સભ્યો માટે : (૧) કંપનીનાં રજીસ્ટ્રાર અને શે ટ્રાન્સફર એજન્ટ, બીગશેર સર્વીસીસ પ્રા.લિ. ને, ફોલીઓ નંબર સાથે, અને સેલ એટેસ્ટેડ પાન કાર્ડની નકલ સાથે Bigshare Services Private Limited Unit: Shree Ganesh Remedies Limited, S6-2, 6" Floor Pinnacle Business Park, Next to Ahura Centre, Mahaka Caves Road, Andheri (East), Mumbai-400093 Maharashtra ને મોકલવી અથવા (૨) investor@bigshareonline.com ને ઇ-મે કરવો.

૨૮ મી એજીએમની નોટિસની ઇલેક્ટ્રોનિક નકલો તેમજ નાણાંકિય વર્ષ ૨૦૨૨-૨ માટેનાં વાર્ષિક અહેવાલ મેળવવાનાં મયાદિત હેતુ માટે ડિમેટ મોડમાં શેર ધરાવતા સભ્ય ઉપરોક્ત સરનામે ઇ-મેલ કરી શકે છે.

કંપની સભ્યોને ઇલેક્ટ્રોનિક માધ્યમથી તેમના મતદાન અધિકારનો ઉપયોગ કરવાને સુવિધા પુરી પાડશે. વીસી/ઓએવીએમ દ્વારા ૨૮મી એજીએમ ની નોટિસમાં (ફીઝીકલ રૂપે શેર ધરાવનાર તેમજ જેઓનાં ઇ-મેલ સરનામાં નોંધાયેલ નથી તેઓ ઇ-વોટિંગ દ્વાર તેમનો મત આપી શકે તે સાથેની સુચનાઓ) જોડાવવાની સુચનાઓ અને પ્રક્રિયા સામેલ

વાર્ષિક સાધારણ સભાની વિગતો કંપનીની વેબસાઇટ www.ganeshremedies.con પર, અને બીએસઇ ની વેબસાઇટ www.bseindia.com પર પણ ઉપલબ્ધ છે.

 $\oplus$ 

શ્રી ગણેશ રેમીડીઝ લિમીટેડ વતી સહી/-

સન્ની નારવાણી

કંપની સેકેટરી

સ્થળ : અંકલેશ્વર વારીખ : ૨૪-૦૮-૨૦૨૩

રજીસ્ટ્રે પ્રોક્યો પાસે, ૩૫૦૨ ૮૧૬૦૮	શન કર રમેન્ટ ટે એલિસવિ ર૧૪૫/૧ ૨૧૪૫/૧	યવી LOG કનોલોજીર લેજ, અમદ ૪૯/૧૮૨,	IN ID અને પાસવર્ડ ૨ ૧ લી. / ઓક્શન ટાઇગ દાવાદ – ૩૮૦૦૦૬ ગુજર praveen.thevar@a	"ઓક્શન સર્વિસ પ્રોવાઇડર" ના ઓનલાઇન પોર્ટલ મારફતે પોતાનુ મગાઉથી મેળવી લેવાના ૨દેશે. <u>ઓક્શન સર્વિસ પ્રોવાઇડર</u> – મે. ઇ- ૨, બી–૭૦૪, વોલ સ્ટ્રીટ–૨, ઓરીએન્ટ ક્લબની સામે, ગુજરાત કોલે૧ રાત (ભારત). સંપર્ક : શ્રી પ્રવિધાકુમાર થેવર – ૯૭૨૨૭૭૮૮૨૮, ૦૭૯- auctiontiger.net અને બેંકમાં સંપર્ક માટે : શ્રી વિકાસ શર્મા -	
				નિચમો, ટેન્ડર ફોર્મમાં સમાવિષ્ટ કરેલ છે જે બેંકની વેબસાઈટ – arfaesi.auctiontiger.net" ઉપર ઉપલબ્ધ છે.	
			com con mapana	લી. અધિકૃત અધિકારી	
તારીખ : સ્થળ : સ				અભ્યુદય કો-ઓપ. બેંક લી.	
	UNCIA	10			
	44		4 1		
B		ऑफ़ ब of Bar	oda अः	આછ <b>ઝોસી રોડ, ચાંદખેડા બ્રાન્ચ ઃ</b> મોલ, ગ્રાઉન્ડ ફ્લોર ૧૦,૧૧,૧૨,૧૫,૧૬, અદણ-કર્તાની એમટીએસ બસ સ્ટેન્ડ સામે, ચાંદખેડા, નોટિસ	
	Title			२४२४, Email-DBCHAK@bankofbaroda.com	
				ાક્ટ, ૨૦૦૨ની કલમ ૧૩(૨) હેઠળ) STERED A.D./Courier	
				ગોકુલ ગેલેક્સી રેસિડેન્સી, ફ્લેટ નં. એ-૨૪/૨૧, ૩જો માળ, ગોકુલ ગેલેક્સી રેસિડેન્સી, ફ્લેટ નં. એ-૨૪/૨૧, ૩જો માળ, એસ પી રીંગ રોડ પાસે, કઠવાડા લેકની સામે, કઠવાડા, અમદાવાદ-૩૮૨૪૩૦ શ્રી કુશવાદ ગોપાલસિંગ (ભામીનદાર-કાચદેસર વારસદાર) ગોકુલ ગેલેક્સી રેસિડેન્સી, ફ્લેટ નં. એ-૨૪/૨૧, ૩જો માળ,	
મોટેશ, સાબ				એસ પી રીંગ રોડ પાસે, કઠવાડા લેકની સામે, કઠવાડા, અમદાવાદ-૩૮૨૪૩૦	
				શ્રી અજીત રાજેશસિંગ કુશવાહ (જામીનદાર-કાચદેસર વારસદાર) ગોકુલ ગેલેક્સી રેસિડેન્સી, ફ્લેટ નં. એ -૨૪/૨૧, ૩જો માળ,	
મહેરબાન સ				એસ પી રીંગ રોડ પાસે, કઠવાડા લેકની સામે, કઠવાડા, અમદાવાદ-૩૮૨૪૩૦	
સુવિધાનો પ્રકાર	લિમીટ રૂપિચા લાખમાં	વ્યાજનો દર	વેલ સુરક્ષા હિતો નીચે પ્રગ બાકી લેણાં (કોન્ટ્રેકચ્ચુઅ લેણાં) નોટિસ તારીખના રો (03-oc-૨૦૨૩ સુધાના વ્યાજ સહિત)	લ શિક્યોરીઠીના દુંકા વર્ણન સાથે સુશ્ક્ષા કરાર (તમામ ખાતામાં ઉપલબ્ધ જ સામાન્ય સિક્યોરીઠીઝ)	
Term Loan (Housing Loan)	8.90	9.15 % (At time of last review)		બી લુશવાઢ ઓમકારસિંગ દશરથસિંગ ની માલિકીની સ્થાવર મિલકતનો તમામ ભાગ અને હિસ્સો- ફ્લેટ નં. એ-૧૯/૨૮, સંત્રરૂળ પ૮.૪૦ થો.મી. સુપર બિલ્ડ અપ એરીવા ૪૨.૩૬૪ થો.મી. વહેંચાયેલ હિસ્સા સાથે, ગોકુલ ગેલેકસી રેસિડેન્સી નામે જાણીતી સ્કીમમાં, બ્લોક એ માં ૩જા માળ પર, સર્ચે નં. ૭૮૮, ૭૮૩, ૭૮૪ અન ૭૮૫, કઠવાડા, તાલુકો દસકોઇ, જિલ્લો અમદાવાદ- ૧૨(નિકોલ) ખાતે આવેલી છે કે જની ચનુ:સીમાં પ્યું ફ્લેટ નં. એ-૧૯/૨૯, પશ્ચિમે ૩૦ મીટર સેડ, ઉત્તરે ૯ મીટર સેડ, દક્ષિણે ફ્લેટ નં. એ-૧૯/૨૭.	
છો. તમે દર્મ ચૂકવવામાં નિ	લોન/ડીય તેપ્ફળ નીવ	માન્ડ લોન્સ હવા છો.	ની ચૂકવણીમાં પણ નિષ્ફળ	ાપની ઉપશેક્ત લોનના બાકી હપા તા.૩૧.૦૩.૨૦૨૧માં ચૂકવવામાં નિષ્ણા નીવડ્ય ગયા છો એટલે કે તા.૩૧.૧૨.૨૦૨૦ના રોજ પૃષ્ત થતા મહિનામાંઅને ત્યાર બા ક ઇન્ડિયાની ગાઇડ લાઇન મુજબ આપનું ખાતું તા.૩૧.૦૩.૨૦૨૧ ના રોજ નોન	
છો, જેની નં	ાંધ લેશો.			વારંવારની વિનંતીઓ છતાં તેમે લોન અને તેનું વ્યાજ ચૂકવવામાં નિષ્ણા નીવડ્ય	
વળવા અક્ષ ઓફ ફાઇના આપીએ છી પેસ નં. ૧મ છે. વધુમા સંદર કાયદા પ) મહેરબા	મતાના સં ન્સિયલ ચ એ, અને i દર્શાવ્યા તોટિસ અ ની કલમ ની કલમ	કર્ભમાં, અને બેસેટસ એ બેંકના કુલ મુજબ અ ાપવામાં અ ૧૩ની પેટા નોંધી લેશો	ા તમાશ એકાઉન્ટને બિન-કા ન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ય લેણાં <b>રૂા.૯,હર,૪૬૧.૧૪ (</b> તે અન્ય ચાર્જીસ વિગેરે આ ાવે છે કે ઉપસેક્ત રકમની કલમ(૪) હેઠળના તમામ ર	તે સુક્ષિત ક્રચલેલ કેડીટ સવલતોને ધ્યાનમાં સાખીને તમાસે જવાબદાસેને પહોંચ (ર્યકાર્સ સંપત્તિ તરીકે વર્ગીડકરણ કરેલ છે, તો સિક્યોસેટાઇઝેશન એન્ડ સિકન્સ્ટ્રક્શન હોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ની કલમ ૧૩(૨) ઠેલ્ઝા અમે તમને અહીં નોટિંસ <b>રુપિયા નવ લાખ બોતેર હજાર યારસો એક્સક અને પૈસા ચૌદ પૂરા)</b> + અન્ય ચાર્જીર : નોટિસ મળયેથી ૬૦ દિવસમાં પૂરેપુરી રકમ ચુકવી દેવા નોટિસ આપવામાં આવં ચુકવણી પેમેન્ટ આવે તે તારીખ સુધીના વ્યાજ સહિત કરવામાં નિષ્ફળ જશો તો અથવા કોઈપણ હડકના ઉપયોગ કરી શકીશું. ઉપરોડત પેસ-૧ માં દર્શાવવામાં આવેલા દરેક રકમની સંપૂર્ણ રૂપે ચૂકવણી	
અન્યથા (બં કરવામાં આ છે જે જાણા	કર કાયદા Iઝનેસની વે છે. સા શો.	ની ૧૩ની પે . સામાન્ય રી ઠર કાયદાની	ાત સિવાયની કોઇપણ), અગ્ સેક્શન ૧૩(૧૩) મુજબ કા	ં ધ્યાન દોરીએ છીએ, જે તમને ઉપરોક્ત પેશ નં.૧ માં વેચાણ, લીઝ અથવા મારી અગાઉની લેખિત સંમતિ પ્રાપ્ત કર્યા વગર સ્થાનાંતસ્તિ કરવા પર પ્રતિબંધિત ધર્વાહી કસુરના સંજોગોમાં સદર કાયદાની કલમ ૨૯ હેઠળ સજા લાયક ગુનો બન્ ) કલમ ૧૩ ની પેટા કલમ ૮ મજબ નીલામી / ટેન્લ્ટ/ અંગત ક્રચરની અંદલેન	
૭) આર્થી આપનું ધ્યાન દોસ્વામાં આવે છે કે સદર ડાયદાની કલમ ૧૩ ની પેદા કલમ ૮ મુજબ નીલામી / દેન્ડર/ અંગત કસરની સંદર્ભેની નોટિસ પબ્લિકેશન તારીખ પહેલાં સદર મિલડત સંદર્ભે બૅંકની બાકી નીકળતી સ્ક્રમ તથા તે પસ્નું વ્યાજ, ખર્ચ તથા અન્ય ચુકવવાની સ્ક્રમ ચુકવી આ મિલકત પરત્વેના તમાસ ઠક્કો સિક્યોર કરી શકો છો. ઉપર મુજબની નોટિસ પ્રસિધ્ધ થયા બાદ આ મિલકત સિક્યોર કરવાના તમારુ ઠક્કો નષ્ટ થશે જેની નીધ લેવા વિનંતી છે.					

ા<u>માં અન્ય અને કરીને અં</u> નોંધી લેશો કે આ ડીમાન્ડ નોટિસ કોઇપણ જાતના પૂર્વગ્રહ વિના અને અન્ય અધિકારોના માફી તરીકે સમજવામાં (૮) મહેરબાની કરીને એ નોંધી લેશો કે આ ડીમાન્ડ નોટિસ કોઇપણ જાતના પૂર્વગ્રહ વિના અને અન્ય અધિકારોના માફી તરીકે સમજવામાં આવશે નહીં, અથવા ઉપાયો કે જે અમારી પાસે લોઇ શકે છે, જેમાં મર્યાદા વિના અમારા માટેના આધારે રક્ષ્મની વધુ માગણી કરવાનો અધિકાર ધરાવીએ છીએ.

અધિકૃત અધિકારી, બેંક ઓફ બરોડા છ્યોસી રોડ ચાંદખેડા બ્રાન્ચ